

-: અખબારી યાદી:-

વોર્ડ નં. ૧૧ માં વિવિધ સોસાયટીના પ્રતિનિધિશ્રીઓ સાથે કોરોના અવેરનેસ મીટીંગ યોજાઈ

તારીખ: ૦૭-૦૮-૨૦૨૦



આજરોજ તારીખ: ૦૭-૦૮-૨૦૨૦ ના રોજ નાનામોવા આરોગ્ય કેન્દ્ર ખાતે વોર્ડ નં . ૧૧ ના નવા વિસ્તાર (અંબીકા ટાઉનશીપ)ના હાઇરાઇઝ બિલ્ડિંગ અને રહેણાક સોસાયટીના પ્રમુખશ્રીઓને કોરોના અવેરનેસ માટે આમંત્રિત કરેલ કરવામાં આવ્યા હતા. આ મીટીંગનો મુખ્ય હેતુ કોરોના અંગે જનજાગૃતિ અને સ્વ-સુરાક્ષા આવે એવો હતો.

આ મિટિંગમાં અંદાજે ૨૦ સોસાયટીના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા, હાજર રહેલ સોસાયટી અને તેના પ્રતિનિધિશ્રીનું નામ નીચે મુજબ છે.

ક્રમ	સોસાયટીનું નામ	પ્રતિનિધીનું નામ
૧	ગોલ ટ્રાયો	કીશનભાઈ કાલરીયા
૨	સાનીધ્ય ગ્રીન	ભરતભાઈ ટીલવા
૩	કીજ્ઞા એપાર્ટમેન્ટ	ગીરીશભાઈ રાજપરા
૪	ઓસમ એપાર્ટમેન્ટ	સેજલ સીતાપરા
૫	તુલસી એપાર્ટમેન્ટ	સમીર કોરડીયા
૬	શ્રી દર્શન એપાર્ટમેન્ટ	જીતુભાઈ ઘોડાસરા
૭	ઓમ રેસીડેન્સી	વિનુભાઈ ભાલારા
૮	તુલસીએ	અરવિંદભાઈ આસોદરીયા

૯	શિવમ પાર્ક	રસિકભાઈ મુંગરા
૧૦	શાંતિવન નિવાસ	મગનભાઈ વાછાણી
૧૧	બ્લુબર્ડ એપાર્ટમેન્ટ	વલ્લભભાઈ સાકરીયા
૧૨	વસંત વાટિકા	રમણીકભાઈ મણવર
૧૩	બ્લુબર્ડ એપાર્ટમેન્ટ	મોહન ભાઈ ભાલોડીયા
૧૪	કસ્તુરી એવીયરી	મહેન્દ્ર ભાઈ ભુવા
૧૫	ઇસ્કોન હાઇટ	અમૃતભાઈ કનેરિયા
૧૬	રિવેરા હોમ એપાર્ટમેન્ટ	હાર્દિક ભાઈ જાવીયા
૧૭	કસ્તુરી કેસલ	મોહિતભાઈ ઘોડાસરા
૧૮	શ્યામલ	પરસોતમભાઈ કાલાવડીયા
૧૯	શાંતિવન પરિસર	નરસિંહભાઈ રૂપાવટીયા
૨૦	ગોલ કોઇન	રમણીકલાલ જાગાણી

આ મિટિંગમાં આવેલ તમામ પ્રતિનિધિને વોર્ડ ઓફિસરશ્રી નીલેશભાઈ કાનાણીએ કોરોના સંદર્ભે જનજાગૃતિ કેળવવા અને કોરોના અંગેની પ્રાથમિક સમજણ આપી હતી.

ત્યારબાદ મેડીકલ ઓફિસરશ્રી ડો. નીશીતાબેન તરફથી કોરોના બાબતે બાળકો અને વૃદ્ધોએ શું સાવચેતી રાખવી તેમજ ખાસ પલ્સ-ઓક્સીમીટર અને ટેમ્પરેચર ગનના ઉપયોગ અંગે ડેમોસ્ટ્રેશન અને માહિતી આપી હતી.

વિશેષમાં વોર્ડ પ્રભારીશ્રી ભાવેશભાઈજોશીએ તમામને તેઓની સોસાયટીમાં pulse oximeter અને ટેમ્પરેચર ગન વસાવવા અને વધુ સુરક્ષિત જાતે જ થવા સમજણ આપેલ તેમજ આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવાર આવતા હોય વિશેષ તકેદારી રાખવા તથા સોશિયલ ડિસ્ટન્સ રાખવા અનુરોધ કર્યો હતો. સાનિધ્ય ગ્રીન, ઓમ રેસીડેન્સી અને શિવમ પાર્કના પ્રમુખશ્રીઓ તેમની સોસાયટીમાં pulse oximeter વસાવી ચેકિંગ ચાલુ કરાવી દીધા હતા , તેમને આ બદલ બિરદાવામાં આવ્યા હતા. તમામ પ્રમુખશ્રીઓને આ ચેકિંગ કાર્યવાહી ચાલુ કર્યા બાદ જો કોઈ વ્યક્તિને લક્ષણો દેખાય તો તાત્કાલીક આરોગ્ય કેન્દ્રની સુવિધાનો લાભ લેવા વિનંતી કરી હતી.

આ તકે સાનિધ્ય ગ્રીન સોસાયટીના પ્રમુખશ્રી ભરતભાઈ ટીલવાએ તેમના દ્વારા પોતાના એપાર્ટમેન્ટ તથા ઇન્ડસ્ટ્રીમાં રાખવામાં આવેલ વિશેષ સાવચેતી અને લીધેલ સુરક્ષિત પગલા અંગે તમામ ઉપસ્થિત સોસાયટીના પ્રમુખશ્રીઓ ને પોતાના અનુભવ ઉપરથી માર્ગદર્શન આપ્યું હતું.

(જન સંપર્ક અધિકારી)
રાજકોટ મહાનગરપાલિકા